



અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

સરદાર વલ્લભભાઈ પટેલ સંકુલ, ઉસ્માનપુરા, આશ્રમરોડ, અમદાવાદ-14

ફોન : (ઓફિસ) 27545051 - 54. ફેક્સ : (079)-27545061

ઈ મેઇલ : auda_urban@yahoo.co.in વેબસાઇટ : www.auda.org.in

FORM: D

નંમુનો: ધ

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો ૧૯૭૯, નિયમ-૧૦

વિકાસ માટે પરવાનગી

શ્રી RAKESHBHAI R. PATEL AUTHORISED SIGNATORY OF SANJAYBHAI R. PATEL & OTHERS/721+722 SHILP EPITOM, B/H RAJPATH CLUB, BODAKDEV, AHMEDABAD ને

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 (સન. 1976 ના રાષ્ટ્રપતિ અધિનિયમ નં 27) ની કલમ-29 (1)(i), 29(1) (ii), 19(1) (b) હેઠળ મોજે ગામ SHELA તાલુકો SANAND જિલ્લો AHMEDABAD નગર રચના યોજના નં. T.P.1(SHELA) રે.સં./બ્લોક નં 364/B/1 હિસ્સા નં -- મુળખંડ નં 94/2 અંતિમખંડ નં 94/2 સબપ્લોટ નં - ટેનામેન્ટ નં ની 3977.00 ચો.મી

જમીનમાં તેમની હદમાં નીચે વર્ણન કર્યા પ્રમાણે આ સાથેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

નિર્દિષ્ટ ટાઇપ : Residential Affordable Housing કામનું વર્ણન:

ક્ર.સં.	માળ	માપકામ(ચોરસ/ચોરસ)નું વર્ણન	માપકામનો ઉપયોગ	એકમની સંખ્યા	રિમાર્ક
(1)	(2)	(3)	(4)	(5)	(6)
1	સેલર/બોયર (૧)	2732.83(2nd)+2804.19(1st)	PARKING	---	
2	ગ્રાઉન્ડ ફ્લોર (હેલોપ્લેન)	1720.94	PARKING+COMMERCIAL+	24(C.)	TOTAL CHARG. F&I : 8735.48 SQ.MT.
3	ફર્સ્ટ ફ્લોર	1437.12	COMMERCIAL+RESIDENTIAL	06(C.)+09(N.)	TOTAL COMMERCIAL 30 UNITS
4	સેકન્ડ ફ્લોર	1338.67	RESIDENTIAL	12	TOTAL RESIDENTIAL 159 UNITS
5	થર્ડ ફ્લોર	1338.67	RESIDENTIAL	12	TOTAL 189 UNITS
6	ફોર્થ ફ્લોર	1338.67	RESIDENTIAL	12	
7	ફાઇથ ફ્લોર	1338.67	RESIDENTIAL	12	
8	સીક્સથ ફ્લોર	1338.67	RESIDENTIAL	12	
9	સેપ્થ ફ્લોર	1338.67	RESIDENTIAL	12	
10	એઈથ ફ્લોર	1338.67	RESIDENTIAL	12	
11	નાઈથ ફ્લોર	1338.67	RESIDENTIAL	12	
12	ટેનથ ફ્લોર	1338.67	RESIDENTIAL	12	
13	ઇલેવેન ફ્લોર	1338.67	RESIDENTIAL	12	
14	ટુવેલ્વ ફ્લોર	1338.67	RESIDENTIAL	12	
15	થર્ટીન ફ્લોર	1338.67	RESIDENTIAL	12	
16	ફોર્ટીન ફ્લોર	759.13	RESIDENTIAL	06	
17	સ્ટેર કેબીન	234.76			
18	મશીન રૂમ	129.68			
	કુલ:	25882.69	PARKING+COMMERCIAL+RESIDENTIAL	189	

ખાસ શરત: 1. પ્રજાવણ સુધિત બાંધકામ અંગે Chief Fire Officer-AMC DT:03/10/2022 ના અભિપ્રાય મુજબ, બાંધકામપૂર્ણ થયે, વપરાશ પ્રમાણ પત્ર મેળવનાર ફાયર સર્વિસ ઓફિસર નું ના-વોંખા પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. તથા C.G.D.C.R મુજબ "Fire Protection Consultant" ની નિમજૂઈ કરવાની શરતે સદર વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 2. સરકારશ્રી ના તા:૧૫/૬/૨૦૧૬ ના નોટીફિકેશન મુજબ બિ.યુ પરમીશન મેળવતાં પહેલાં જરૂરી INSURANCE મેલવી ને રજુ કરવાના રહેશે. 3. As Per applicable Provision of Real Estate Regulation And Development Act-2016, Developer/promoter shall not Make Advertisement For Sale, Marketing, Booking, Or Offer For Real Estate Projects like plot, Apartment Or Building Or Part of their, Until The Registration Is Done with Gujarat Real Estate Regulatory Authority (RERA). 4. રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ-૨૦૧૬(RERA)ની જોગવાઈ ૧૪.(૨).(II) મુજબ રીવાઈઝ્ડ વિકાસ પરવાનગી વખતે અરજદારશ્રી ઘરા નોટીસશઝ બાંહેધરી રજુ કરવાની રહેશે. 5. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં ઠરાવ ક્રમાંક: ઇડબ-૧૦૨૦૧૮-૫૨૩૧-તા.૧૧/૦૭/૨૦૧૮ મુજબ રીવાઈઝ્ડ વિકાસ પરવાનગી (એડીસન-એડ્ડેરેશન) ના કેસોમાં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ-૨૦૧૬(RERA) ની જોગવાઈ ૧૪.(૨).(II) મુજબ બાંધકામના બેતર્તિયાન્ય (૨/૩) એલોટીની સંમતી (નોટીસશઝ બાંહેધરી) મેળવ્યાં બાદ રીવાઈઝ્ડ વિકાસ પરવાનગીની કાર્યવાહી કરવામાં આવશે. 6. બી.યુ પરમીશન મેળવતાં પહેલાં સી.જી.ડી.સી.આર-૨૦૧૭ મુજબ ૩૬ ટોપ સોલાર એનર્જી ઇસ્ટોલેશન કરવાની શરતે સદર વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 7. પોટેબલ તથા ટ્રીટેડ પાણીની બે અલગ-અલગ ટાંકીઓનું આયોજન તથા તે અનુસાર ડબલ પ્લમ્બીંગ સીસ્ટમનું આયોજન કરવાનું રહેશે. તે શરતે આ વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 8. સ્ટકયર સેફ્ટી અર્થે બેઝમેન્ટના ખોદાણ પૂર્વે કાચકામ વોલનું આયોજન કરવાની શરતે વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 9. વરસાદી પાણીના નિકાલ માટે બેઝમેન્ટમાં યોગ્ય કેપેસિટીના ડિસ્ટ્રીબ્યુટીંગ પંપનું આયોજન કરવાનું રહેશે. 10. તા:14/11/2022 ની બાંહેધરી મુજબ પ્રજાવણી જમીન ઉપર સુધિત 20,000 ચો.મી. કરતાં વધારાનું લે-આઉટ પ્લાન મા "PINK" હેય કરી દર્શાવેલ બાંધકામ મુદ્દ કરતાં પહેલાં Environment clearance certificate રજુ કરવાની શરતે વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

રવાના કર્યું, મારફત

23 JAN 2023

નોંધ પર મુ.કા.અ.શ્રીની સહી છે

IFP No/E-nagar : JSK/10/2022/0138

ક્રમાંક: PRM/101/10/2022/16

તારીખ: 20/01/2023



જુનિયર નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ.

સિનીયર નગર નિયોજક

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ

ખાસ શરતો:-

- આ વિકાસ પરવાનગીથી સી.જી.ડી.સી.આર ના વિનિયમ નં.૨૦ મુજબ તેમજ અન્ય લાગુ પડતા કાયદા/નિયમો અન્વયેની પરવાનગીઓ મળતી નથી.
- વિકાસ પરવાનગી મેળવ્યા બાદ સ્થળ ઉપર વિકાસ શરૂ કરતા પહેલા સાત દિવસ અગાઉ ડોમેન ૨(ડ) નું એનેક્સર, સ્ટુકચરલ ડ્રોઇંગ્સ, વડીંગ ડ્રોઇંગ્સ તથા સોઇલ ઈન્વેસ્ટીગેશન રીપોર્ટ સબમિટ કરવાનું રહેશે.
- બાધકામ નીચેના દરેક તબક્કે ડોમેન નં-૧૦ માં દર્શાવેલ મુજબ કમેન્સમેટ રીપોર્ટ તથા ડ્રોમ નં ૧૧ માં દર્શાવ્યા મુજબનું પ્રોગ્રેસ સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે અને સત્તામંડળ તરફથી પરવાનગી મેળવ્યા બાદ જ આગળના તબક્કાનું બાધકામ શરૂ કરવાનું રહેશે. અ. પતીનું અથવા ભોયરાનું બાધકામ હોય તો ભોયરા ઉપરનો સ્લેબ ભરવામાં આવે તે પહેલાં બ. પ્રથમ માળના ૬. બહુમાળી મકાનમાં વધેના માળના બાધકામ વખતે ૬. છેલ્લા માળના બાધકામ વખતે
- સી.જી.ડી.સી.આર ની જોગવાઈ તથા સરકારીના તા.૨૯-૫-૨૦૧૯ ના સ્ટુકચરલ સેક્ટરી અંગેના હુકમના વિનિયમ નં ૩ અનુસાર બાધકામના સ્થળની જરૂરિયાતોની જોગવાઈઓનું પાલન થયેથી સ્થળ ઉપર બાધકામ શરૂ કરવાનું રહેશે.
- સેપ્ટિક ટેક તથા સોલવેલની સાઈઝ તથા સખ્યા નેશનલ બિલ્ડીંગ કોડ (આઈએસ ૨૪૭૦) તથા સી.જી.ડી.સી.આર ના વિનિયમ નં ૧૩ ૧૦ ૧ મુજબ મીવરેજ ના નિર્માણની વ્યવસ્થા કરવાની રહેશે તે અનુસારની જોગવાઈ કરવાની જવાબદારી આઈટેકચર/ઈજનેર/ સ્ટુકચરલ એન્જીનીયર/ડેલેટ સુપરવાઈઝર/ડેલેટ પરીજીન માલિકની રહેશે.
- ચીફ ફાયર ઓફિસરશ્રી, અ. મ્યુ.કોપો ના અધિપાય મુજબ તમામ નિયમો અને શરતોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- ટેલીકોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટની જોગવાઈ મુજબ ટેલીફોનની સુવિધા માટે ખાસ જોગવાઈ જમીન માલિકે કરવાની રહેશે.
- સી.જી.ડી.સી.આર. વિનિયમ નં.૫.૨ તથા ૫.૩ મુજબની તમામ માહિતી સ્થળ ઉપર (નોટીસ બોર્ડ) પ્રસિધ્ધ કરવાની રહેશે.
- બાધકામ પૂણે થયા બાદ બાધકામનો ઉપયોગ શરૂ કરતા પહેલાં નિયામનુસાર અત્રેથી બાધકામનું વપરાશ અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ વપરાશ શરૂ કરવાનો રહેશે.
- ૧.ડા.ટી.પી. સ્કીમ સરકાર શ્રી બરા મજુર થયેલ, ટી.પી.ઓ.બરા નિણેય લેવામાં આવશે તે બધનકતા રહેશે.
- રેલવેથી ૩૦૦ મી. કન્વેલ લાઈનમાં આવતા મકાનોનું બી.યુ. પરમીશન લેતા પહેલાં રેલવેની N.O.C લાવવાની રહેશે.
- ૧૧ સી.જી.ડી.સી.આર વિનિયમ નં.૧૬ તથા ૧૮ મુજબ અરજદારશ્રી/ડેલેટ પરીજી/કબજદારશ્રી ઓ એ વેતવાનું રહેશે.

શરતો:-

- વિકાસ પરવાનગી પત્રમાં દર્શાવેલ શરતોનો ભંગ કરવામાં આવશે તો સત્તામંડળ તે શરતોનો અમલ જવાબદાર ઈસમના/સંસ્થાના બંધે અને જોખમે કરાવી શકશે અને સત્તામંડળના તેવા કૃત્યને લીધે જે નુકસાન, ખોટ કે હરકત થાય તે બદલ કોઈપણ વળતર કે બદલો મળશે નહીં.
- વિકાસ પરવાનગીના કારણે અરજદારને સી.જી.ડી.સી.આર ૩.૩.૧ (A,B,C,D,E) અંગેની મજુરી મળતી નથી પરંતુ બાધકામ અંગેની મજુરી આપવામાં આવે છે.
- વિકાસ પરવાનગીથી બાનગી હક્કો અંગે સત્તામંડળની કોઈપણ જવાબદારી રહેતી નથી.
- મુસદ્દાપત્ર નગર રચના યોજનામાં ફાળવવામાં આવેલ અંતિમખંડની હદ, માપ, ક્ષેત્રફળ તથા ફાળવણી ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રી બરા ફેરફારને ખાતર છે.
- પ્લોટની હદ, આંતરિક રસ્તા ઉપર, ડોમેન પ્લોટમાં કોઈને અતરય રૂપ ન થાય, તે રીતે યોગ્ય સ્થળોએ સી.જી.ડી.સી.આર ના વિનિયમ (પા.૧૧) ૧૨ મુજબના (સી.જી.ડી.સી.આર ૧૬.૧.૨) મુજબના ઉગાડવાનો રહેશે. વૃક્ષો ની કરતે જરૂરીયાત મુજબ ટ્રી ગાર્ડ શાખી વૃક્ષો ની સારસંભાળ રાખવાની જવાબદારી જમીન માલિક તથા વિકાસ પરવાનગી મેળવનારની રહેશે.
- લેઆઉટમાં દર્શાવેલ આંતરિક રસ્તાઓ પાકા કરવાના રહેશે.
- બ્રખતો વખત શહેરી વિકાસ સત્તામંડળ તરફથી વિકાસ માટેના જે નિયમો તથા જાહેરાત ફાયર તે જમીન માલિક, ફિતસબધ ધરાવતી વ્યક્તિ/સંસ્થા તેમજ અરજદારને બધનકતો રહેશે.
- સદર વિકાસ પરવાનગી અન્વયે જમીન માલિકીમાં ફેરફાર થાય અથવા આ પરવાનગી સાથે સંકળાયેલ રજીસ્ટ્રેશન ધરાવતી કોઈ વ્યક્તિ બદલાય તો નવા જમીન માલિક અંગેના પુરાવા રજૂ કરે ત્યાં સુધી તથા રજીસ્ટ્રેશન ધરાવતી નવી વ્યક્તિની નિમણૂક ન થાય ત્યાં સુધી સી.જી.ડી.સી.આર /સી.જી.ડી.સી.આર ના વિનિયમ ૪.૫/૪.૬ મુજબ વિકાસ પરવાનગી નિલબીત ગણાશે. સદર સમય દરમિયાન થયેલ બાધકામ પ્રિનાયકિત ગણાશે.
- શરદારશ્રીના તા.૨૬.૫.૨૦૦૧ ના સ્ટુકચરલ સેક્ટરી અંગેના હુકમના વિનિયમ ૧૧.૧૪.૧૫ ની જોગવાઈ અનુસાર ભૂકપ અંગેની સુરક્ષા, ચક્રવાત અંગેની સુરક્ષા, બાધકામ તથા બાધકામમાં વપરાતા ઈમારતી માલ સામાનની ગુણવત્તા અને તેની ચકાસણી, બાધકામની સ્થિતિ તથા આગ અંગેની સલામતી તેમજ અન્ય અવગત બાબતે અંગે નિષ્ણતાની સલાહ મુજબ પગલા લેવાની તમામ જવાબદારી આઈટેકચર/ઈજનેર/ સ્ટુકચરલ એન્જીનીયર/ડેલેટ ઓફ વર્ક/સાઇટ સુપરવાઈઝર/ડેલેટ પરીજીન માલિકની રહેશે. આ અને સત્તામંડળ ની કોઈ જવાબદારી રહેશે નહીં.
- આ વિકાસ પરવાનગી પત્ર મજુરી આપ્યા તારીખથી બાર માસ સુધીજ અમલમાં રહેશે. ત્યારબાદ અધિનિયમની કલમ-૩૨ મુજબ વિકાસ પરવાનગીની મુદત વધારવાની પૂર્વ મજુરી મેળવી લેવાની રહેશે.
- ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ ૩૩ મુજબ વિકાસ યોજનામાં જો કોઈ ફેરફાર થાય તો સત્તામંડળ આપેલ વિકાસ પરવાનગીમાં ફેરફાર કરી શકશે અથવા વિકાસ પરવાનગી રદ કરી શકશે.
- સી.જી.ડી.સી.આર/સી.જી.ડી.સી.આર ના વિનિયમ (PART 1) ૩.૪/૪.૬ મુજબ અરજદારશ્રીએ ખોટી રજૂઆત અથવા ખોટા દસ્તાવેજ પુરાવા રજૂ કરેલ હશે તો આપેલ વિકાસ પરવાનગી બાંધો ત્યાં ૨૯ થયેલ ગણાશે.
- "મકાન અને અન્ય બાધકામ કામદારો (રોજગારનું નિયમન અને સેવાની શરતો) પારો-૧૯૯૬" હેઠળ દરેક માલિકે બાધકામ પ્રવૃત્તિ શરૂ કરવાના ૩૦(ત્રીસ) દિવસ પહેલાં સદર કાયદા હેઠળના નિયત ડોમેન-૪ મુજબની નોટીસ તેમજ બાધકામ શરૂ કરવાના ૬૦ દિવસમાં જરૂરી સાઇટના નોંધણી કાયદરકર ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરી ડેવલપમેન્ટ એક્ટ, ૧૯૪૬, ૧૯૪૭, ૧૯૪૮, ૧૯૪૯, ૧૯૫૦, ૧૯૫૧, ૧૯૫૨, ૧૯૫૩, ૧૯૫૪, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૫૭, ૧૯૫૮, ૧૯૫૯, ૧૯૬૦, ૧૯૬૧, ૧૯૬૨, ૧૯૬૩, ૧૯૬૪, ૧૯૬૫, ૧૯૬૬, ૧૯૬૭, ૧૯૬૮, ૧૯૬૯, ૧૯૭૦, ૧૯૭૧, ૧૯૭૨, ૧૯૭૩, ૧૯૭૪, ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭, ૧૯૭૮, ૧૯૭૯, ૧૯૮૦, ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૮૪, ૧૯૮૫, ૧૯૮૬, ૧૯૮૭, ૧૯૮૮, ૧૯૮૯, ૧૯૯૦, ૧૯૯૧, ૧૯૯૨, ૧૯૯૩, ૧૯૯૪, ૧૯૯૫, ૧૯૯૬, ૧૯૯૭, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૦, ૨૦૦૧, ૨૦૦૨, ૨૦૦૩, ૨૦૦૪, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪, ૨૦૨૫, ૨૦૨૬, ૨૦૨૭, ૨૦૨૮, ૨૦૨૯, ૨૦૩૦, ૨૦૩૧, ૨૦૩૨, ૨૦૩૩, ૨૦૩૪, ૨૦૩૫, ૨૦૩૬, ૨૦૩૭, ૨૦૩૮, ૨૦૩૯, ૨૦૪૦, ૨૦૪૧, ૨૦૪૨, ૨૦૪૩, ૨૦૪૪, ૨૦૪૫, ૨૦૪૬, ૨૦૪૭, ૨૦૪૮, ૨૦૪૯, ૨૦૫૦, ૨૦૫૧, ૨૦૫૨, ૨૦૫૩, ૨૦૫૪, ૨૦૫૫, ૨૦૫૬, ૨૦૫૭, ૨૦૫૮, ૨૦૫૯, ૨૦૬૦, ૨૦૬૧, ૨૦૬૨, ૨૦૬૩, ૨૦૬૪, ૨૦૬૫, ૨૦૬૬, ૨૦૬૭, ૨૦૬૮, ૨૦૬૯, ૨૦૭૦, ૨૦૭૧, ૨૦૭૨, ૨૦૭૩, ૨૦૭૪, ૨૦૭૫, ૨૦૭૬, ૨૦૭૭, ૨૦૭૮, ૨૦૭૯, ૨૦૮૦, ૨૦૮૧, ૨૦૮૨, ૨૦૮૩, ૨૦૮૪, ૨૦૮૫, ૨૦૮૬, ૨૦૮૭, ૨૦૮૮, ૨૦૮૯, ૨૦૯૦, ૨૦૯૧, ૨૦૯૨, ૨૦૯૩, ૨૦૯૪, ૨૦૯૫, ૨૦૯૬, ૨૦૯૭, ૨૦૯૮, ૨૦૯૯, ૨૧૦૦, ૨૧૦૧, ૨૧૦૨, ૨૧૦૩, ૨૧૦૪, ૨૧૦૫, ૨૧૦૬, ૨૧૦૭, ૨૧૦૮, ૨૧૦૯, ૨૧૧૦, ૨૧૧૧, ૨૧૧૨, ૨૧૧૩, ૨૧૧૪, ૨૧૧૫, ૨૧૧૬, ૨૧૧૭, ૨૧૧૮, ૨૧૧૯, ૨૧૨૦, ૨૧૨૧, ૨૧૨૨, ૨૧૨૩, ૨૧૨૪, ૨૧૨૫, ૨૧૨૬, ૨૧૨૭, ૨૧૨૮, ૨૧૨૯, ૨૧૩૦, ૨૧૩૧, ૨૧૩૨, ૨૧૩૩, ૨૧૩૪, ૨૧૩૫, ૨૧૩૬, ૨૧૩૭, ૨૧૩૮, ૨૧૩૯, ૨૧૪૦, ૨૧૪૧, ૨૧૪૨, ૨૧૪૩, ૨૧૪૪, ૨૧૪૫, ૨૧૪૬, ૨૧૪૭, ૨૧૪૮, ૨૧૪૯, ૨૧૫૦, ૨૧૫૧, ૨૧૫૨, ૨૧૫૩, ૨૧૫૪, ૨૧૫૫, ૨૧૫૬, ૨૧૫૭, ૨૧૫૮, ૨૧૫૯, ૨૧૬૦, ૨૧૬૧, ૨૧૬૨, ૨૧૬૩, ૨૧૬૪, ૨૧૬૫, ૨૧૬૬, ૨૧૬૭, ૨૧૬૮, ૨૧૬૯, ૨૧૭૦, ૨૧૭૧, ૨૧૭૨, ૨૧૭૩, ૨૧૭૪, ૨૧૭૫, ૨૧૭૬, ૨૧૭૭, ૨૧૭૮, ૨૧૭૯, ૨૧૮૦, ૨૧૮૧, ૨૧૮૨, ૨૧૮૩, ૨૧૮૪, ૨૧૮૫, ૨૧૮૬, ૨૧૮૭, ૨૧૮૮, ૨૧૮૯, ૨૧૯૦, ૨૧૯૧, ૨૧૯૨, ૨૧૯૩, ૨૧૯૪, ૨૧૯૫, ૨૧૯૬, ૨૧૯૭, ૨૧૯૮, ૨૧૯૯, ૨૨૦૦, ૨૨૦૧, ૨૨૦૨, ૨૨૦૩, ૨૨૦૪, ૨૨૦૫, ૨૨૦૬, ૨૨૦૭, ૨૨૦૮, ૨૨૦૯, ૨૨૧૦, ૨૨૧૧, ૨૨૧૨, ૨૨૧૩, ૨૨૧૪, ૨૨૧૫, ૨૨૧૬, ૨૨૧૭, ૨૨૧૮, ૨૨૧૯, ૨૨૨૦, ૨૨૨૧, ૨૨૨૨, ૨૨૨૩, ૨૨૨૪, ૨૨૨૫, ૨૨૨૬, ૨૨૨૭, ૨૨૨૮, ૨૨૨૯, ૨૨૩૦, ૨૨૩૧, ૨૨૩૨, ૨૨૩૩, ૨૨૩૪, ૨૨૩૫, ૨૨૩૬, ૨૨૩૭, ૨૨૩૮, ૨૨૩૯, ૨૨૪૦, ૨૨૪૧, ૨૨૪૨, ૨૨૪૩, ૨૨૪૪, ૨૨૪૫, ૨૨૪૬, ૨૨૪૭, ૨૨૪૮, ૨૨૪૯, ૨૨૫૦, ૨૨૫૧, ૨૨૫૨, ૨૨૫૩, ૨૨૫૪, ૨૨૫૫, ૨૨૫૬, ૨૨૫૭, ૨૨૫૮, ૨૨૫૯, ૨૨૬૦, ૨૨૬૧, ૨૨૬૨, ૨૨૬૩, ૨૨૬૪, ૨૨૬૫, ૨૨૬૬, ૨૨૬૭, ૨૨૬૮, ૨૨૬૯, ૨૨૭૦, ૨૨૭૧, ૨૨૭૨, ૨૨૭૩, ૨૨૭૪, ૨૨૭૫, ૨૨૭૬, ૨૨૭૭, ૨૨૭૮, ૨૨૭૯, ૨૨૮૦, ૨૨૮૧, ૨૨૮૨, ૨૨૮૩, ૨૨૮૪, ૨૨૮૫, ૨૨૮૬, ૨૨૮૭, ૨૨૮૮, ૨૨૮૯, ૨૨૯૦, ૨૨૯૧, ૨૨૯૨, ૨૨૯૩, ૨૨૯૪, ૨૨૯૫, ૨૨૯૬, ૨૨૯૭, ૨૨૯૮, ૨૨૯૯, ૨૩૦૦, ૨૩૦૧, ૨૩૦૨, ૨૩૦૩, ૨૩૦૪, ૨૩૦૫, ૨૩૦૬, ૨૩૦૭, ૨૩૦૮, ૨૩૦૯, ૨૩૧૦, ૨૩૧૧, ૨૩૧૨, ૨૩૧૩, ૨૩૧૪, ૨૩૧૫, ૨૩૧૬, ૨૩૧૭, ૨૩૧૮, ૨૩૧૯, ૨૩૨૦, ૨૩૨૧, ૨૩૨૨, ૨૩૨૩, ૨૩૨૪, ૨૩૨૫, ૨૩૨૬, ૨૩૨૭, ૨૩૨૮, ૨૩૨૯, ૨૩૩૦, ૨૩૩૧, ૨૩૩૨, ૨૩૩૩, ૨૩૩૪, ૨૩૩૫, ૨૩૩૬, ૨૩૩૭, ૨૩૩૮, ૨૩૩૯, ૨૩૪૦, ૨૩૪૧, ૨૩૪૨, ૨૩૪૩, ૨૩૪૪, ૨૩૪૫, ૨૩૪૬, ૨૩૪૭, ૨૩૪૮, ૨૩૪૯, ૨૩૫૦, ૨૩૫૧, ૨૩૫૨, ૨૩૫૩, ૨૩૫૪, ૨૩૫૫, ૨૩૫૬, ૨૩૫૭, ૨૩૫૮, ૨૩૫૯, ૨૩૬૦, ૨૩૬૧, ૨૩૬૨, ૨૩૬૩, ૨૩૬૪, ૨૩૬૫, ૨૩૬૬, ૨૩૬૭, ૨૩૬૮, ૨૩૬૯, ૨૩૭૦, ૨૩૭૧, ૨૩૭૨, ૨૩૭૩, ૨૩૭૪, ૨૩૭૫, ૨૩૭૬, ૨૩૭૭, ૨૩૭૮, ૨૩૭૯, ૨૩૮૦, ૨૩૮૧, ૨૩૮૨, ૨૩૮૩, ૨૩૮૪, ૨૩૮૫, ૨૩૮૬, ૨૩૮૭, ૨૩૮૮, ૨૩૮૯, ૨૩૯૦, ૨૩૯૧, ૨૩૯૨, ૨૩૯૩, ૨૩૯૪, ૨૩૯૫, ૨૩૯૬, ૨૩૯૭, ૨૩૯૮, ૨૩૯૯, ૨૪૦૦, ૨૪૦૧, ૨૪૦૨, ૨૪૦૩, ૨૪૦૪, ૨૪૦૫, ૨૪૦૬, ૨૪૦૭, ૨૪૦૮, ૨૪૦૯, ૨૪૧૦, ૨૪૧૧, ૨૪૧૨, ૨૪૧૩, ૨૪૧૪, ૨૪૧૫, ૨૪૧૬, ૨૪૧૭, ૨૪૧૮, ૨૪૧૯, ૨૪૨૦, ૨૪૨૧, ૨૪૨૨, ૨૪૨૩, ૨૪૨૪, ૨૪૨૫, ૨૪૨૬, ૨૪૨૭, ૨૪૨૮, ૨૪૨૯, ૨૪૩૦, ૨૪૩૧, ૨૪૩૨, ૨૪૩૩, ૨૪૩૪, ૨૪૩૫, ૨૪૩૬, ૨૪૩૭, ૨૪૩૮, ૨૪૩૯, ૨૪૪૦, ૨૪૪૧, ૨૪૪૨, ૨૪૪૩, ૨૪૪૪, ૨૪૪૫, ૨૪૪૬, ૨૪૪૭, ૨૪૪૮, ૨૪૪૯, ૨૪૫૦, ૨૪૫૧, ૨૪૫૨, ૨૪૫૩, ૨૪૫૪, ૨૪૫૫, ૨૪૫૬, ૨૪૫૭, ૨૪૫૮, ૨૪૫૯, ૨૪૬૦, ૨૪૬૧, ૨૪૬૨, ૨૪૬૩, ૨૪૬૪, ૨૪૬૫, ૨૪૬૬, ૨૪૬૭, ૨૪૬૮, ૨૪૬૯, ૨૪૭૦, ૨૪૭૧, ૨૪૭૨, ૨૪૭૩, ૨૪૭૪, ૨૪૭૫, ૨૪૭૬, ૨૪૭૭, ૨૪૭૮, ૨૪૭૯, ૨૪૮૦, ૨૪૮૧, ૨૪૮૨, ૨૪૮૩, ૨૪૮૪, ૨૪૮૫, ૨૪૮૬, ૨૪૮૭, ૨૪૮૮, ૨૪૮૯, ૨૪૯૦, ૨૪૯૧, ૨૪૯૨, ૨૪૯૩, ૨૪૯૪, ૨૪૯૫, ૨૪૯૬, ૨૪૯૭, ૨૪૯૮, ૨૪૯૯, ૨૫૦૦, ૨૫૦૧, ૨૫૦૨, ૨૫૦૩, ૨૫૦૪, ૨૫૦૫, ૨૫૦૬, ૨૫૦૭, ૨૫૦૮, ૨૫૦૯, ૨૫૧૦, ૨૫૧૧, ૨૫૧૨, ૨૫૧૩, ૨૫૧૪, ૨૫૧૫, ૨૫૧૬, ૨૫૧૭, ૨૫૧૮, ૨૫૧૯, ૨૫૨૦, ૨૫૨૧, ૨૫૨૨, ૨૫૨૩, ૨૫૨૪, ૨૫૨૫, ૨૫૨૬, ૨૫૨૭, ૨૫૨૮, ૨૫૨૯, ૨૫૩૦, ૨૫૩૧, ૨૫૩૨, ૨૫૩૩, ૨૫૩૪, ૨૫૩૫, ૨૫૩૬, ૨૫૩૭, ૨૫૩૮, ૨૫૩૯, ૨૫૪૦, ૨૫૪૧, ૨૫૪૨, ૨૫૪૩, ૨૫૪૪, ૨૫૪૫, ૨૫૪૬, ૨૫૪૭, ૨૫૪૮, ૨૫૪૯, ૨૫૫૦, ૨૫૫૧, ૨૫૫૨, ૨૫૫૩, ૨૫૫૪, ૨૫૫૫, ૨૫૫૬, ૨૫૫૭, ૨૫૫૮, ૨૫૫૯, ૨૫૬૦, ૨૫૬૧, ૨૫૬૨, ૨૫૬૩, ૨૫૬૪, ૨૫૬૫, ૨૫૬૬, ૨૫૬૭, ૨૫૬૮, ૨૫૬૯, ૨૫૭૦, ૨૫૭૧, ૨૫૭૨, ૨૫૭૩, ૨૫૭૪, ૨૫૭૫, ૨૫૭૬, ૨૫૭૭, ૨૫૭૮, ૨૫૭૯, ૨૫૮૦, ૨૫૮૧, ૨૫૮૨, ૨૫૮૩, ૨૫૮૪, ૨૫૮૫, ૨૫૮૬, ૨૫૮૭, ૨૫૮૮, ૨૫૮૯, ૨૫૯૦, ૨૫૯૧, ૨૫૯૨, ૨૫૯૩, ૨૫૯૪, ૨૫૯૫, ૨૫૯૬, ૨૫૯૭, ૨૫૯૮, ૨૫૯૯, ૨૬૦૦, ૨૬૦૧, ૨૬૦૨, ૨૬૦૩, ૨૬૦૪, ૨૬૦૫, ૨૬૦૬, ૨૬૦૭, ૨૬૦૮, ૨૬૦૯, ૨૬૧૦, ૨૬૧૧, ૨૬૧૨, ૨૬૧૩, ૨૬૧૪, ૨૬૧૫, ૨૬૧૬, ૨૬૧૭, ૨૬૧૮, ૨૬૧૯, ૨૬૨૦, ૨૬૨૧, ૨૬૨૨, ૨૬૨૩, ૨૬૨૪, ૨૬૨૫, ૨૬૨૬, ૨૬૨૭, ૨૬૨૮, ૨૬૨૯, ૨૬૩૦, ૨૬૩૧, ૨૬૩૨, ૨૬૩૩, ૨૬૩૪, ૨૬૩૫, ૨૬૩૬, ૨૬૩૭, ૨૬૩૮, ૨૬૩૯, ૨૬૪૦, ૨૬૪૧, ૨૬૪૨, ૨૬૪૩, ૨૬૪૪, ૨૬૪૫, ૨૬૪૬, ૨૬૪૭, ૨૬૪૮, ૨૬૪૯, ૨૬૫૦, ૨૬૫૧, ૨૬૫૨, ૨૬૫૩, ૨૬૫૪, ૨૬૫૫, ૨૬૫૬, ૨૬૫૭, ૨૬૫૮, ૨૬૫૯, ૨૬૬૦, ૨૬૬૧, ૨૬૬૨, ૨૬૬૩, ૨૬૬૪, ૨૬૬૫, ૨૬૬૬, ૨૬૬૭, ૨૬૬૮, ૨૬૬૯, ૨૬૭૦, ૨૬૭૧, ૨૬૭૨, ૨૬૭૩, ૨૬૭૪, ૨૬૭૫, ૨૬૭૬, ૨૬૭૭, ૨૬૭૮, ૨૬૭૯, ૨૬૮૦, ૨૬૮૧, ૨૬૮૨, ૨૬૮૩, ૨૬૮૪, ૨૬૮૫, ૨૬૮૬, ૨૬૮૭, ૨૬૮૮, ૨૬૮૯, ૨૬૯૦, ૨૬૯૧, ૨૬૯૨, ૨૬૯૩, ૨૬૯૪, ૨૬૯૫, ૨૬૯૬, ૨૬૯૭, ૨૬૯૮, ૨૬૯૯, ૨૭૦૦, ૨૭૦૧, ૨૭૦૨, ૨૭૦૩, ૨૭૦૪, ૨૭૦૫, ૨૭૦૬, ૨૭૦૭, ૨૭૦૮, ૨૭૦૯, ૨૭૧૦, ૨૭૧૧, ૨૭૧૨, ૨૭૧૩, ૨૭૧૪, ૨૭૧૫, ૨૭૧૬, ૨૭૧૭, ૨૭૧૮, ૨૭૧૯, ૨૭૨૦, ૨૭૨૧, ૨૭૨૨, ૨૭૨૩, ૨૭૨૪, ૨૭૨૫, ૨૭૨૬, ૨૭૨૭, ૨૭૨૮, ૨૭૨૯, ૨૭૩૦, ૨૭૩૧, ૨૭૩૨, ૨૭૩૩, ૨૭૩૪, ૨૭૩૫, ૨૭૩૬, ૨૭૩૭, ૨૭૩૮, ૨૭૩૯, ૨૭૪૦, ૨૭૪૧, ૨૭૪૨, ૨૭૪૩, ૨૭૪૪, ૨૭૪૫, ૨૭૪૬, ૨૭૪૭, ૨૭૪૮, ૨૭૪૯, ૨૭૫૦, ૨૭૫૧, ૨૭૫૨, ૨૭૫૩, ૨૭૫૪, ૨૭૫૫, ૨૭૫૬, ૨૭૫૭, ૨૭૫૮, ૨૭૫૯, ૨૭૬૦, ૨૭૬૧, ૨૭૬૨, ૨૭૬૩, ૨૭૬૪, ૨૭૬૫, ૨૭૬૬, ૨૭૬૭, ૨૭૬૮, ૨૭૬૯, ૨૭૭૦, ૨૭૭૧, ૨૭૭૨, ૨૭૭૩, ૨૭૭૪, ૨૭૭૫, ૨૭૭૬, ૨૭૭૭, ૨૭૭૮, ૨૭૭૯, ૨૭૮૦, ૨૭૮૧, ૨૭૮૨, ૨૭૮૩, ૨૭૮૪, ૨૭૮૫, ૨૭૮૬, ૨૭૮૭, ૨૭૮૮, ૨૭૮૯, ૨૭૯૦, ૨૭૯૧, ૨૭૯૨, ૨૭૯૩, ૨૭૯૪, ૨૭૯૫, ૨૭૯૬, ૨૭૯૭, ૨૭૯૮, ૨૭૯૯, ૨૮૦૦, ૨૮૦૧, ૨૮૦૨, ૨૮૦૩, ૨૮૦૪, ૨૮૦૫, ૨૮૦૬, ૨૮૦૭, ૨૮૦૮, ૨૮૦૯, ૨૮૧૦, ૨૮૧૧, ૨૮૧૨, ૨૮૧૩, ૨૮૧૪, ૨૮૧૫, ૨૮૧૬, ૨૮૧૭, ૨૮૧૮, ૨૮૧૯, ૨૮૨૦, ૨૮૨૧, ૨૮૨૨, ૨૮૨૩